

[A-18-GUJ] Seat No: _____

No. of Printed Pages: 2

SARDAR PATEL UNIVERSITY
B. Com. (Vth Semester) (NC) Examination
Friday, 13th May, 2016
2.30 – 4.30 pm
UB05CCOM10
Financial Management

કુલ ગુણ: ૬૦

નોંધ: જમણી બાજુના આંક પ્રશ્નના ગુણ દર્શાવે છે.

પ્ર.૧ નાણાંકીય સંચાલનની વ્યાખ્યા આપો. સંચાલકીય નાણાં કાર્યો અને રૂઢિગત નાણાં કાર્યો સવિસ્તર સમજાવો. (૧૫)

અથવા

પ્ર.૧

(અ) નાણાંકીય સંચાલનનું મહત્વ સમજાવો. (૦૭)

(બ) નાણાંકીય સંચાલનના હેતુઓની ચર્ચા કરો. (૦૮)

પ્ર.૨

(અ) નાણાંકીય આયોજન એટલે શું ? નાણાંકીય આયોજનને અસર કરતા પરિબલોની ચર્ચા કરો. (૧૧)

(બ) નાણાંકીય આયોજનની મર્યાદાઓ સમજાવો. (૦૪)

અથવા

પ્ર.૨ અતિ-મૂડીકરણ એટલે શું ? અતિ-મૂડીકરણનાં કારણો, અસરો અને ઉપાયો સમજાવો. (૧૫)

પ્ર.૩ ‘ઇકવીટી શેર’ અને ‘ડિબેન્ચર’નું લાંબા ગાળાના નાણાંકીય સ્ત્રોત તરીકે મૂલ્યાંકન કરો. (૧૫)

અથવા

પ્ર.૩ નીચે દર્શાવેલ નાણાંકીય સ્ત્રોતોના લાભા-લાભ જણાવો. (૧૫)

(૧) જાહેર થાપણો

(૨) વેપારી બેંકો

(૩) આંતરિક નાણાંસ્ત્રોત

પ્ર.૪

(અ) મૂડી અંદાજપત્ર એટલે શું ? મૂડી અંદાજપત્રની પ્રક્રિયાના તબક્કાઓનું વર્ણન કરો.

(૧૦)

(બ) ટૂંકનોંધ લખો: મૂડીની માપબંધી

(૦૫)

અથવા

પ્ર.૪ એક પ્રોસેસીંગ હાઉસ ચંત્ર ખરીદવા ઇચ્છે છે.

(૧૫)

નીચે મુજબની માહિતી પ્રાપ્ત થયેલ છે :

વિગત	રકમ (રૂ.)
ચંત્રની કિંમત	૧૦૪૦૦૦૦
ચંત્રનું આયુષ્ય	૫ વર્ષ
ચંત્રની ભંગાર કિંમત	૪૦૦૦૦

આ ચંત્રમાંથી ઉદભવતા વેચાણ અને ખર્ચાઓ નીચે મુજબ છે.

	પ્રથમ વર્ષ (રૂ.)	બીજું વર્ષ (રૂ.)	ત્રીજું વર્ષ (રૂ.)	ચોથું વર્ષ (રૂ.)	પાંચમું વર્ષ (રૂ.)
વેચાણ	૬૦૦૦૦૦	૬૮૦૦૦૦	૮૦૦૦૦૦	૮૬૦૦૦૦	૯૬૦૦૦૦
કુલ ખર્ચા (ઘસારો અને કરવેરા સિવાય)	૨૮૦૦૦૦	૩૨૦૦૦૦	૪૦૦૦૦૦	૪૨૦૦૦૦	૪૮૦૦૦૦

ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણવામાં આવે છે. કંપનીના નફા પર ૪૦ % લેખે કરવેરાનો દર લાગુ પડે છે. મૂડી પડતરનો દર ૧૨ % છે. નીચેની પદ્ધતિઓને આધારે મૂડી રોકાણનું મૂલ્યાંકન કરો.

(અ) પરત-આપ મુદ્દતની પદ્ધતિ

(બ) સરેરાશ વળતરના દરની પદ્ધતિ

(ક) ચોખ્ખું વર્તમાન મૂલ્ય (૧૨ % વટાવના દરે)

(ડ) નફાકારકતાનો આંક (૧૨ %ના વટાવના દરે)

૧૨ %ના વટાવ દરે રૂ. ૧ નું પ્રથમ પાંચ વર્ષ માટેનું વર્તમાન મૂલ્ય આ પ્રમાણે છે.

૦.૮૯૩, ૦.૭૯૭, ૦.૭૧૨, ૦.૬૩૫ અને ૦.૫૬૭

